



અધિકાર-૫

સંવર અધિકાર

‘હવે સંવર પ્રવેશ કરે છે’

ત્યાં (સંવર અધિકારની) શરૂઆતમાં જ, (ભગવાન કુંદુંદાચાયે)
સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદવિજ્ઞાન તેની પ્રશંસા
કરે છે :—

ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ કોધાદિમાં,
છ કોધ કોધ મહીં જ, નિશ્ચય કોધ નહિ ઉપયોગમાં. ૧૮૧.

ઉપયોગ છે નહિ અષ્ટવિધ કર્મો અને નોકર્મમાં,
કર્મો અને નોકર્મ કંઈ પણ છે નહિ ઉપયોગમાં. ૧૮૨.

આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભબે છે જીવને,
ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગશુદ્ધાત્મા કરે. ૧૮૩.

ગાથાર્થ :—ઉપયોગ ઉપયોગમાં છે, કોધાદિકમાં કોઈ ઉપયોગ
નથી; વળી કોધ કોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી કોધ નથી. આઠ
પ્રકારનાં કર્મ તેમ જ નોકર્મમાં ઉપયોગ નથી અને ઉપયોગમાં કર્મ તેમ
જ નોકર્મ નથી.—આવું અવિપરીત જ્ઞાન જ્યારે જીવને થાય છે, ત્યારે
તે ઉપયોગસ્વરૂપ શુદ્ધાત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો
નથી. ॥૧૮૧-૧૮૩॥

હવે પૂછે છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ
(અનુભવ) કઈ રીતે થાય છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છે :—

જ્યમ અગ્નિતપ્ત સુવર્ણ પણ નિજ સ્વર્ણભાવ નહીં તજે,
ત્યમ કર્મઉદ્યે તપન પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. ૧૮૪.

જીવ જ્ઞાની જ્ઞાણે આમ, પણ અજ્ઞાની રાગ જ જીવ ગણે,
આત્મસ્વભાવ-અજ્ઞાણ જે અજ્ઞાનતમ-આચ્છાદને. ૧૮૫.

ગાથાર્થ :—જેમ સુવર્ણ અભિનથી તપણ થયું થકું પણ તેના સુવર્ણપણાને છોડતું નથી તેમ જ્ઞાની કર્મના ઉદ્દ્યથી તપણ થયો થકો પણ જ્ઞાનીપણાને છોડતો નથી.—આવું જ્ઞાની જ્ઞાણે છે, અને અજ્ઞાની અજ્ઞાન-અંધકારથી આચ્છાદિત હોવાથી આત્માના સ્વભાવને નહિ જ્ઞાણતો થકો રાગને જ આત્મા માને છે. ॥૧૮૪-૧૮૫॥

હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર કઈ રીતે થાય છે? તેનો ઉત્તર કહે છે :—

જે શુદ્ધ જ્ઞાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે;
અણશુદ્ધ જ્ઞાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. ૧૮૬.

ગાથાર્થ :—શુદ્ધ આત્માને જ્ઞાણતો-અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે અને અણશુદ્ધ આત્માને જ્ઞાણતો-અનુભવતો જીવ અણશુદ્ધ આત્માને જ પામે છે. ॥૧૮૬॥

હવે પૂછું છે કે સંવર ક્યા પ્રકારે થાય છે? તેનો ઉત્તર કહે છે :—

પુષ્યપાપયોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી,
દર્શન અને જ્ઞાને ઠરી, પરદવ્યઈચ્છા પરિહરી, ૧૮૭.

જે સર્વસંગવિમુક્ત, ધ્યાવે આત્મને આત્મા વડે,—
—નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને, ૧૮૮.

તે આત્મ ધ્યાતો, જ્ઞાનદર્શનમય, અનન્યમયી ખરે,
બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. ૧૮૯.

ગાથાર્થ :—આત્માને આત્મા વડે બે પુષ્ય-પાપરૂપ શુભાશુભયોગોથી રોકીને દર્શનજ્ઞાનમાં સ્થિત થયો થકો અને અન્ય

(વस્તુ)ની ઈચ્છાથી વિરમ્યો થકો, જે આત્મા, (ઈચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થયો થકો, (પોતાના) આત્માને આત્મા વડે ધ્યાવે છે— કર્મ અને નોકર્મને ધ્યાતો નથી, (પોતે) યોતયિતા (હોવાથી) એકત્વને જ ચિંતવે છે—ચેતે છે—અનુભવે છે, તે (આત્મા), આત્માને ધ્યાતો, દર્શનજ્ઞાનમય અને અનન્યમય થયો થકો અલ્ય કાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે. ॥૧૮૭-૧૮૮॥

હવે પૂછે છે કે સંવર કયા કર્મે થાય છે? તેનો ઉત્તર કહે છે :—

રાગાદ્ધિના હેતુ કહે સર્વજ્ઞ અધ્યવસાનને,
—મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ તેમ જ યોગને. ૧૮૦.

હેતુઅભાવે જરૂર આસ્તવરોધ જ્ઞાનીને બને,
આસ્તવભાવ વિના વળી નિરોધ કર્મ તણો બને; ૧૮૧.

કર્મો તણા ય અભાવથી નોકર્મનું રોધન અને
નોકર્મના રોધન થકી સંસારસંરોધન બને. ૧૮૨.

ગાથાર્થ :—તેમના (પૂર્વ કહેલા રાગદ્વેષમોહરૂપ આસ્તવોના) હેતુઓ સર્વદર્શીઓએ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતભાવ અને યોગ—એ (ચાર) અધ્યવસાન કહ્યા છે. જ્ઞાનીને હેતુઓના અભાવે નિયમથી આસ્તવનો નિરોધ થાય છે, આસ્તવભાવ વિના કર્મનો પણ નિરોધ થાય છે, વળી કર્મના અભાવથી નોકર્મનો પણ નિરોધ થાય છે, અને નોકર્મના નિરોધથી સંસારનો નિરોધ થાય છે. ॥૧૮૦-૧૮૨॥

આ રીતે સંવર (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.

રંગભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો તેને જ્ઞાને જાણી લીધો તેથી તે નૃત્ય કરી બહાર નીકળી ગયો.

શ્રીમદ્ભગવત્કુંદુરાચાર્યદ્વારા પ્રાણીત શ્રી સમયસાર શાસ્ત્રનો સંવરનો પ્રરૂપક પાંચમો અંક સમાપ્ત થયો.

* * *